



HDI-1601300201010100 Seat No. _____

First Year B. A. (Sem. I) (CBCS) Examination

November / December – 2017

Geography : Paper - I

(Elements of Physical Geography - I)

(Elective - I) (New Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70]

- Sૂચના : (૧) દરેક પ્રક્રિયાત છે.
 (૨) જરૂર હોય ત્યાં સ્વચ્છ આકૃતિ નકશા દોરો.

- ૧ પ્રાકૃતિક ભૂગોળ એટલે શું ? પ્રાકૃતિક ભૂગોળમાં ભૂરચનાશાસ્ત્રના સ્થાનની ચર્ચા કરો. ૧૪

અથવા

- ૧ સૂર્યમંડળ એટલે શું ? સૂર્યમંડળના ગ્રહોનો પરિચય આપો. ૧૪

- ૨ પૃથ્વીની ઉત્પત્તિ અંગે જેમસ જન્સ અને જેફરીના ભરતીવાદના સિદ્ધાંતની આકૃતિ સહિત ચર્ચા કરો. ૧૪

અથવા

- ૨ “સમતુલાનું સમાયોજન ‘સમસ્તિતિ’ને કાજે થયા કરે છે. - સમતુલા ભौગોલિક શક્તિ કે પરિબળ નથી પરન્તુ એક પરિસ્થિતિ છે”. ચર્ચા કરો. ૧૪

- ૩ ખડકો એટલે શું ? અહિનું ખડકો વિષે વિસ્તૃત નોંધ લખો. ૧૪

અથવા

- ૩ વેગનરના ખંડપ્રવહન સિદ્ધાંત સમજાવો. ૧૪

- ૪ ભૂક્રમ્ય એટલે શું ? ભૂક્રમ્યનાં મોજાઓ અને અસરોની ચર્ચા કરો. ૧૪

અથવા

- ૪ ભુખંડનિર્માણકારી અને ગિરી-નિર્માણકારી પ્રક્રિયાઓ સમજાવો અને સ્તરભંગ કિયા વિષે લખો. ૧૪

- ૪ ટૂંકનોંધ લખો : (ગમે તે બે) ૧૪
- (૧) પૃથ્વીની વય
 - (૨) જવાણામુખીના પ્રકારો
 - (૩) જમીનનું પાશ્ચયિત્ર
 - (૪) ગેરીકરણાના પ્રકારો

ENGLISH VERSION

Instructions : (1) All questions carry equal marks.
 (2) Draw neat diagram /map wherever necessary.

- 1 What is Physical Geography ? Explain the Place of Geomorphology in Physical Geography. 14

OR

- 1 What is solar system? Give the introduction of solar system 14

- 2 Describe in detail about the tidal theory of James Jeans and Zeffre with diagrams. 14

OR

- 2 "Isostasy is the condition i.e., state of balance, it is not the geographical force." Discuss. 14

- 3 What is rock system? Describe the different types of Igneous rocks in detail. 14

OR

- 3 Critically examine the Wegner's continental drift Theory. 14

- 4 What is Earth quake ? Discuss the different waves and causes of earthquake. 14

OR

- 4** Explain the Orogenesis and Epireogenesis process and describe faulting Process in detail. **14**
- 5** Write short notes : (Any **Two**) **14**
- (1) Ages of Earth
 - (2) Types of volcanoes
 - (3) Soils Profile
 - (4) Types of folding
-